

### Advisors

Adoor Gopalakrishnan  
Subodh Sarkar  
Sitanshu Yashaschandra  
K Satchidanandan  
Laxman Gaikwad  
C. Gouridasan Nair  
Bose Krishnamachari  
Sachin Ketkar  
Uma da Cunha  
S Prasannarajan

### Festival Director

Mohan Kakanadan

### Executive Directors

Sabarinath M  
Joseph Alexander  
KJ Bennychan

## 22-24 ફેબ્રુઆરી, 2018ના ગેટવે લિટફેસ્ટની ચોથી આવૃત્તિ

- ભારતીય સાહિત્યની સ્ત્રીશક્તિ મુખ્ય વિષય રહેશે.
- 20 ભાષાની 50 લેખિકા સાથે લેખિકાઓનો વિશાળ મેળાવડો.

**મુંબઈ:** ભારતીય ભાષાઓમાં અવ્વલ લેખકો માટેનું સૌથી વિશાળ મંચ ગેટવે લિટફેસ્ટની ચોથી વૃત્તિ 22-24 ફેબ્રુઆરી, 2018ના એનસીપીએ ખાતે યોજાશે, જેની મુખ્ય થીમ ભારતીય સાહિત્યમાં સ્ત્રી શક્તિ રહેશે.

ભાષા લેખન માટે અવ્વલ અને સૌથી પ્રતિષ્ઠિત ઉપક્રમ તરીકે ખ્યાતિપ્રાપ્ત ગેટવે લિટફેસ્ટ સ્ત્રી લેખિકાઓનો સૌથી મોટો મેળાવડો બની રહેશે, જેમાં 20 ભાષાની 50થી વધુ નામાંકિત અને ભાવિ લેખિકાઓ ઉપરાંત સાહિત્ય તથા ફિલ્મ ક્ષેત્રનાં અન્ય 20 ટોચનાં નામો એક છત હેઠળ આવશે.

આ કાર્યક્રમ પ્રાદેશિક ભાષા લેખનની ઉજવણી કરવા માટે અનોખું રાષ્ટ્રીય મંચ બની રહેશે, જેનું આયોજન સંયુક્ત રીતે મુંબઈ સ્થિત મલયાલમ પ્રકાશન કાક્કા અને કોમ્પ્યુનિકેશન કન્સલ્ટન્સી પેશન4કોમ્પ્યુનિકેશન (પી4સી) દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આસામી, અહિરાની, બંગાળી, ભોજપુરી, અંગ્રેજી, ગુજરાતી, હિંદી, ખાસી, કાશ્મીરી, કોંકણી, કોસાલી, મલયાલમ, મરાઠી, મણિપુરી, મૈથિલી, ઓડિયા, પંજાબી, સિંધુ, તેલુગુ, કન્નડ અને તમિળની નામાંકિત લેખિકાઓ આ ત્રણ દિવસની સાહિત્ય જંબુરીમાં હાજરી આપશે.

છેલ્લી ત્રણ આવૃત્તિમાં લગભગ બધી ભાષાના 200થી વધુ નામાંકિત લેખકોએ ભાગ લીધો હતો, જેમાં ભાષાઓની સીમા નહીં રાખતાં સૌએ ભારતીય સાહિત્યમાં નવા પ્રવાહો પર ચર્ચાવિચારણા અને વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. દરેક આવૃત્તિ સાથે આકાર અને દરજ્જામાં તેની વૃદ્ધિ થઈ રહી છે, એમ ફેસ્ટિવલના ડાયરેક્ટર મોહન કક્કાનાડને જણાવ્યું હતું.

મુખ્ય વિષયના ભાગરૂપ ખાસ સત્રો 2017માં સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર વિજેતાઓ યુવા લેખિકાઓ માટે યોજાશે. આ સત્રમાં અંગ્રેજીમાં લેખિકાઓનો નવો ફાલ, સ્ત્રીઓ દ્વારા આત્મચરિત્ર અને બોલ્ડ લેખન, આંશિકીય પ્રવાહો અને ભાષાંતર જેવા વિષયો આવરી લેવાશે.

KAAKKA



P4C



## Advisors

Adoor Gopalakrishnan  
Subodh Sarkar  
Sitanshu Yashaschandra  
K Satchidanandan  
Laxman Gaikwad  
C. Gouridasan Nair  
Bose Krishnamachari  
Sachin Ketkar  
Uma da Cunha  
S Prasannarajan

## Festival Director

Mohan Kakanadan

## Executive Directors

Sabarinath M  
Joseph Alexander  
KJ Bennychan

દરેક ભારતીય ભાષાનો પ્રવાહ પોતાની ક્ષમતાઓ દ્વારા પોતાના કાર્યક્ષેત્રમાં લોકપ્રિય સ્થાપિત અને ઊભરતી લેખિકાઓની સ્વર્ણિમ યાદી ધરાવે છે. જોકે અંગ્રેજી લેખકોની જેમ રાષ્ટ્રીય સ્તરે અમે તેમનાં કાર્યો અને બુદ્ધિને સન્માનિત કરતાં નથી.

આથી અમે આ ઉપક્રમમાં આ મુદ્દા પ્રત્યે રાષ્ટ્રીય ધ્યાન દોરવા માગીએ છીએ, એમ એકિઝક્યુટિવ ડાયરેક્ટર જોસેફ એલેક્ઝેન્ડરે જણાવ્યું હતું.

આ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે આપણી ભાષાના લેખક- લેખિકાઓને એકસમાન તક મળે ને આંતરભાષા ચર્ચાને પ્રોત્સાહન મળે તે રીતે તૈયાર કરવામાં આવ્યા છે. ભારત ભાષાની દૃષ્ટિથી વૈવિધ્યપૂર્ણ છે, પરંતુ બધા સાહિત્યના પ્રવાહો એકસમાન તાંતાણું ધરાવે છે. રાષ્ટ્રીય અખંડતા અને રાષ્ટ્રીય સ્તરની ભાષાની ઉજવણી અહીં થાય છે, એમ એકિઝક્યુટિવ ડાયરેક્ટર એમ સબરીનાથે જણાવ્યું હતું.

જ્ઞાનપીઠ વિજેતાઓ પ્રતિભા રે (ઓડિયા), ક્લિમકાર અપર્ણા સેન (બંગાળી), અંજુ માખીજા (અંગ્રેજી), દેવિકા જે (મલયાલમ), ઈન્દુ મેનન (મલયાલમ), કનકા હા (કન્નડ), કાર્તિકા વી કે (તમિળ), મલિકા અમર શેખ (મરાઠી), નંદિની સુંદર (અંગ્રેજી), નિરૂપમા દત્ત (પંજાબી), પેટ્રિશિયા મુખીમ (મેઘાલય), પ્રજ્ઞા પવાર (મરાઠી), પ્રો. ચલ્લાપલ્લી સ્વરૂપ રાની (તેલુગુ), તરન્નુમ રિયાઝ (ઉર્દૂ), સુજા સેઝેન (મલયાલમ), તેમસુલા આઓ (ઈશાન), પદ્મશ્રી (આસાની) જેવાં લેખિકાઓ ભેગાં થશે.

નામાંકિત ક્લિમકાર અદુર ગોપાલકૃષ્ણન, બંગાળી લેખક સુબોધ સરકાર, પીઠ ગુજરાતી કવિ સિતાંશુ યશશ્ચંદ્ર, મરાઠી લેખક લક્ષ્મણ ગાયકવાડ, મલયાલમ કવિ કે કરિચદાનંદન, ગુજરાતી લેખક સચિન કેતકર, આર્ટ ક્યુરેટર બોસ કૃષ્ણામાચારી, ઉમા દા કુન્ડા, પીઠ પત્રકાર સી ગૌરીદાસન નાયર અને ઓપન મેગેઝીન સંપાદક એસ પ્રસન્નારાજન ફેસ્ટના સલાહકારો છે.

પુસ્તક પ્રદર્શન, કવિતા પઠન, નેટવર્કિંગ કાર્યક્રમો આ ઈવેન્ટની શાન વધારશે, જે ભાષાંતર, વાંચવાની આદતો, ભાષાની ઉત્ક્રાંતિ અને રંગમંચમાં સ્ત્રીઓનો સહભાગ જેવા અલગ અલગ પ્રવાહો પર ચર્ચા પણ કરશે.

છેલ્લી આવૃત્તિ 25 અને 26 ફેબ્રુઆરી, 2017ના રોજ યોજાઈ હતી, જેમાં ભારતીય સાહિત્યનો સમકાલીન ચહેરો મુખ્ય થીમ હતી અને તેમાં પાંચ યુનિટી ભારતીય ભાષા બંગાળી, મરાઠી, તમિળ, પંજાબી અને મલયાલમ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.

For Further Details: **Mohan Kakanadan**  
**Mobile- 9820556869**  
**e-mail-[gatewaylitfest@gmail.com](mailto:gatewaylitfest@gmail.com)**  
**Website- [www.gatewaylitfest.com](http://www.gatewaylitfest.com)**